

દિલ્લી પોલીસની ટીમ સાથે રહી, દિલ્લીમાં કુખ્યાત નમસ્તે ગેંગના લીડરને ઝડપી પાડતી, સુરત શહેર કાઇમ બ્રાંચ.

દિલ્લી વેસ્ટ સ્પેશીયલ સ્ટાફના પો.સ.ઈ. શ્રી રાજેન્દ્રસિંહ ઠાકા તેઓના સ્ટાફ સાથે દિલ્લીમાં ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપી જાવેદ ઉફ્ જેડી મો.ઈલીયાસને ઝડપી પાડવા સુરત આવેલ અને કાઈમ બ્રાંચના પોલીસ ઈન્સપેક્ટરશ્રીનો સંપર્ક કરી આરોપીને પકડવા જરૂરી મદદ માંગેલ. જે કામે મદદ માટે આરોપીના નામ તથા નંબર આધારે ખાનગી રાહે તપાસ કરાવતા હકીકત મળેલ કે આરોપીએ તેના ભાઈ સાથે ટેક્ષટાઈલ માર્કેટમાં કાપડની દુકાન શરૂ કરેલ છે. જ્યાં ચાર કલાક વોચ કર્યા બાદ આરોપી જાવેદ ઉફ્ જેડી મો.ઈલીયાસ ઉ.વ.૩૦ રહે. ફ્લેટ નં.૫૦૫, રાહત પેલેસ, વેડરોડ, સુરત. મુળ રહેવાસી સી/૧૯૧, ગલી નં.૧, મુસ્તફાબાદ, કરવાલનગર, નવી દિલ્લી તથા સુરતમાં દુકાન પર આવતા તેને ઝડપી પાડી મજકુર દિલ્લી ઈન્ડ્રપુરી પો.સ્ટે. ગુ.ર.નં. ૫૦/૨૦૧૯ ઈ.પી.કો. ૩૯૨ મુજબના ગુનામાં નાસતો ફરતો હોઈ કાયદેસરની કાર્યવાહી કરી, નામ.કોર્ટમાં રજૂ કરી દિલ્લી લઈ જવા તજવીજ કરવામાં આવેલ છે. મજકુર આરોપી દિલ્લીમાં નમસ્તે ગેંગનો લીડર છે. મજકુરની ટીમમાં કુલ છ સભ્યો સામેલ છે. તેઓની એમ.ઓ. છે કે, દિલ્લીમાં તેઓ છ લોકો ત્રણ મોપેડ પર સવાર થઈ નીકળે અને રસ્તે જતી ફોર વ્હીલ ગાડીમાં એકલા લોકો હોય તેઓને જોવે, ત્યારબાદ ફોર વ્હીલ ગાડી પાસે પોતાનું મોપેડ લઈ જઈ બે થી ત્રણ વાર નમસ્તે અંકલ બોલે ત્યારબાદ ગાડીમાં બેસેલ વ્યક્તિ ગાડી ઉભી રાખી જ્યારે ગાડીનો કાય બોલે ત્યારે ઓળખ્યો નહીં. હું ડોક્ટર શર્મા અથવા ઈન્સપેક્ટર સિંગ અથવા અન્ય કોઈપણ મોટા અધિકારી તરીકેની પોતાની ઓળખ આપી, વાતચીત કરે અને તે દરમ્યાન ગાડીનો દરવાજો ખોલી ગાડીમાં બેસી તેની પાસે રહેલ પીસ્ટલ તુરંત જ ગાડી ચલાવનાર ઈસમના શરીર પર રાખી જે કાંઈ રૂપીયા, મોબાઈલ, ઘડીયાળ અને કિંમતી વસ્તુ હોઈ તે લઈ લેતા. આ દરમ્યાન તેની એક ટીમ બીજા મોપેડ સાથે ગાડીના ડ્રાઈવર સાઈડના દરવાજે ઉભા રહી જતા અને એક ટીમ ગાડીની આગળ મોપેડ ઉભુ રાખી દેતા જેથી ગાડી ચાલક ગાડીમાંથી ઉતરી ભાગી ન શકે કે, ગાડી ભગાવી ન શકે. ગુનાને અંજામ આપ્યા બાદ તુરંત આ ગેંગના લોકો રોંગ સાઈડમાં પોતાના મોપેડ લઈ ભાગી જતા જેથી ગાડી ચાલક તેઓનો પીછો ના કરી શકે. મજકુર આરોપી દિલ્લીમાં હત્યાની કોશીષના-૨, આર્મ્સ એક્ટના-૩, લુંટના-૧૦, કેસમા પકડાઈ ચુકેલ છે.